


લાવો બુધ્ધિના દેવ ગણેશને સ્માર્ટ બની, ઉજવો ઇકો ફ્રેન્ડલી ગણેશ ચતુર્થી



ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તી:




આપણા પર્યાવરણને બચાવવા માટે રસાયણ, પ્લાસ્ટર ઓફ પેરીસ, પ્લાસ્ટીક, થર્મોકોલથી બનેલી ગણેશજીની મૂર્તીના બદલે કુદરતી પર જ પસંદગી ઉતારીએ અને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તી ઘરે લાવીએ. જેથી કરીને વિસર્જનના સમયે તળાવ/ નદી / સમુદ્ર વગેરે જેવા જળાશયોને પ્રદૂષીતના થવું પડે છે. જળાશયના બચાવ માટે કૃત્રીમ નિમજ્જન ટાંકીનો ઉપયોગ કરીએ અને આપણી આસપાસના લોકોને પણ તેમજ કરાવવા માટે સૂચવીએ.

મોટા કદની મૂર્તીને ટાળો:

મધ્યમ કદની પ્રમાણસર મૂર્તીની સ્થાપના કરીએ, જેથી વધારે પ્રમાણમાં માટીનો ઉપયોગ ટાળી શકાય અને આસપાસના વિસ્તારમાં વધુ કચરો ના પ્રસારે મોટી માટીની મૂર્તી વધુ જગ્યા રોકે છે અને ઓગળવા માટે વધારે સમય લાગે છે તેની હેરફેર માટે ટ્રાન્સપોર્ટમાં પણ તકલીફ પડે છે. ગણેશ ચતુર્થીમાં ધાર્મિક વિધિ પર વધુ ધ્યાન આપવું નહીં કે પ્રદર્શન પર.



ઘર-ઘર સ્થાપના બદલે સમૂહમાં સ્થાપના:




ગલી કે શેરીમાં સામૂહિક ગણેશજીની સ્થાપના કરવી જે આર્થિક, સામાજિક અને પર્યાવરણમાં વધુ અનુકૂળ રહે.

સજાવટમાં કુદરતી ઉત્પાદનો જ ઉપયોગ કરવો.:

ગુલાવ, ચંદન, હળદર, મેંદદી અને ચોખાના ઉપયોગ કરીને રંગોળી બનાવવી. સુશોભન માટે પણ કાપડ, લાકડું, ફુલોનો જ ઉપયોગ કરવો જેથી એક કરતા વધુ વખત ઉપયોગમાં લઈ શકાય. નોન-બાયોડીગ્રેડલનો ઉપયોગ ટાળવો જોઈએ.



વીજળી બચાવો:



પરંપરાગત બલ્બના બદલે LED લાઇટનો ઉપયોગ કરવો. જે ઓછા પ્રમાણમાં વીજળીનો વપરાશ કરે છે. ખર્ચાળ અને ચાઇનીઝ બલ્બને બદલે રંગીન કાગળને LED લાઇટ પર લપેટીને રંગીન લાઇટમાં ઉજવણી કરીએ.

અવાજ - ઘોંઘાટ પ્રદૂષણથી દૂર રહો:

સીનીયર સીટીઝન, દર્દીઓ અને બાળકોને ખલેલ પહોંચે તે રીતે ઘોંઘાટ કરવાનું ટાળો. નિયમોનું પાલન કરો અને રાત્રીના ૧૦ વાગ્યે અવાજ બંધ કરી દેવો. ફટાકડા આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, માટે તેનો ઉપયોગ ટાળવો.



પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળો:



પ્લાસ્ટીક છોડી અને કેળાના પાંદડા અને ખાખરાના પાનથી બનેલા પતરાળાનો જેવી કુદરતી પ્લેટમાં પ્રસાદ આપવો અને પ્રસાદ લઈ જવા માટે કાપડની બેગનો ઉપયોગ કરવો.